

વીરનિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીમાં થયેલ

# જૈન ન્યાયનો વિકાસ

[ હાર્ષનિક ગ્રંથકારો અને ગ્રંથોનો દુંડું પરિચય ]

લેખક-પુ. મુનિમહુરાજ શ્રી ધુરંધરવિજયજી, શિરપુર

એ

ક સમય એવો હતો કે જેમાં શ્રદ્ધાવાદને બહુ મહત્વ આપાતું અને જનતાને કહેવામાં આવતું તે-નિયોગપર્યનુયોગનર્હ સુનેર્વચ્ચઃ । મુનિતું વચ્ચન તર્ક અને પ્રશ્નથી પર છે. વળી પુરાણં માનવો ધર્મઃ, સાજ્ઞા વેવદશ્ચિ-કિત્સિતમ् । આજ્ઞાસિદ્ધાનિ ચત્વારિ, ન હન્તવ્યાનિ હેતુમિઃ । ‘પુરાણુ, મનુશે બતાવેલ ધર્મ, (છે) અંગ સહિત વેદ અને વૈદ્ધ, એ ચાર વાનાં આજ્ઞાસિદ્ધ છે. તેને તર્કો વડે હણુવાં નહિ.’ આવા શ્રદ્ધાવાદથી ભોળી જનતા એટલી તો ભોળવાઈ ગઈ હતી કે શાસ્ત્રવાક્યનું નામ સાંભળ્યું કે તેનો કંઈ પણ ઉપાય ચાલતો નહિ. આ વાદનું એટલું તો જેર હતું કે તર્કવાદીને રહેવું પણ કઠિન શર્ચ પડતું, શ્રદ્ધાવાદીએ તર્કવાદી સાથેનો સર્વ સમ્બન્ધ છોડી હોતા હતા. ‘શ્રદ્ધાવાદથી લાભ છે કે તુકસાન એ વાત બાળુશે મૂડીએ તો પણ માનવની સ્વાર્થદૂતિએ તે વાદથી ધર્ણો જ અનર્થ પેદા કર્યો હતો. હિંસામય યજયાગાહિ આ વાદથી જ જન્મ પામ્યા હતા. એ અનર્થ એટલે સુધી પહોંચ્યો હતો કે અશ્વમેધ યાગ અને નરમેધ યાગ કરાતા, લોહી અને ચામડાની (રક્તવતી અને ચર્મધૂવતી) નદીએ વહેતી હતી.

આ સમયે જનતાને તર્કવાદની ખાસ આવશ્યકતા હતી. તર્કવાદ સિવાય આ અનર્થનાં જડ-મૂલ નિકળે તેમ ન હતાં. તેવા સમયે પરમહૃપાલુ અગવાન મહાવીરસ્વામીજી ઉત્તેજન થયા. તેમણે યુક્તિવાદોનો સૂર્ય ઉગાડ્યો, અને તર્કવાદીઓને પ્રોત્સાહન આપ્યું. તેઓશ્રી તર્કવાદીઓના પુરોગાની અન્યા, ધન્દભૂતિ વગરે વિગ્રહ કેવળ શ્રદ્ધાવાદથી-વેવચયનમાં યુક્તિના અભાવથી આત્મા, સ્વર્ગ, પુણ્ય, પાપ, પરલવ આદિમાં શક્તિ થયા હતા તે સર્વને મહાવીર પ્રભુએ યુક્તિમાર્ગની દિશા બતાવી, તે જ વેવચયનોથી સ્થિર કર્યો હતા. મહાવીર સ્વામીએ પ્રોત્સાહન ઉપરેથને તર્કસિદ્ધ બનાવ્યો હતો. કોઈ પણ તત્ત્વ કે કોઈ પણ પદાર્થની દેશના આશે હેતુએ તો હોય જ. તેથી જ સ્થળે સ્થળે ગૌતમસ્વામીજી પ્રભુને પ્રશ્નો પૂછતા કે કે કેળાઢેણ મન્ત્ર ! એવમુશ્વાહ ? લગવન્ત ! આમ શા કારણુથી કહેવાય છે ? મહાવીર-સ્વામીજી પોતાના ઉપ્રેસિત માર્ગને નૈયાયિક-ન્યાયસિદ્ધ માર્ગ કહેતા હતા, જે માટે તેઓથીએ જ કંદું છે કે :

૧. તર્કવાદી સમન્યેલ શ્રદ્ધાવાદ એ કલ્યાણસાધનનો રાજમાર્ગ છે. તે માર્ગનો પણ કેવળ ચર્મધૂવતી પણ નથી કપાતો. તેમ કેવળ શ્રદ્ધાવાદી પણ નથી કપાતો. એ અન્ને, રથના એકેક બન્ધા. છ. ‘ચક્રાભ્યાં ચલતિ રૂપઃ’ એ પ્રમાણે બન્ધે ચક્રો મળે તો જ આ ધર્મરથ ચાલે છે.

નેયાઉં સુઅક્ષાયં, ઉવાદાય સમીહપ ॥

ન્યાયુક્તા આગમને અહણુ કરીને (તેને) ધર્યે છે.

સોચા નેયાઉં મગ્ગાં, બહુવે પરિમસ્સિ ॥

નૈયાયિક ભાર્ગને સાંભળવા છતાં પણ ડેટલાએક (શ્રદ્ધાથી) રહિત રહે છે.

આવા પ્રકારના કથનને આધારે પાછળના આચાર્યાએ તેમને માટે લખ્યું કે:

અસ્તિ વક્તવ્યતા કાચિત्, તેનેદં ન વિચાર્યતે ।

નિર્દોષં કાશ્વનં ચેત્ સ્યાત्, પરીક્ષાયા બિમેતિ કિમ् ॥

‘હજુ કંઈક કહેવાપણું છે તેથી આ (વેદ વગેરે શાસ્ત્રો) વિચારાતાં નથી. જે નિર્દોષ સોનું હોય તો પરીક્ષાથી શા માટે બીજે છે?’

નિકષચ્છેદતાપેભ્યઃ, સુવર્જમિવ પણ્ડતૈः ।

પરીક્ષ્ય ભિક્ષબો ગ્રાહ્યં, મદ્ધચો ન તુ ગૌરવાત् ॥

‘હે મુનિઓ ! પંડિતો જેમ ક્ષ, છેદ અને તાપથી પરીક્ષા કરીને સોનું લે છે તેમ તમારે પણું માંતું વચ્ચેન પરીક્ષા કરીને અહણ કરતું, પણ માત્ર મહત્તમી ન લેતું.’

એ પ્રમાણે પ્રભુશ્રી મહાનિરસ્વામીએ જનતામાં તર્કવાદની રૂચિ ઉત્પન્ન કરી અને જનતાને પરીક્ષક બનાવીને ઉપદેશ આપ્યો.

સમય જતાં આ યુક્તિવાદના પરિપાદ ઇથે ન્યાય-સૂર્ય ઉદ્દ્યવંત થયો, ગણુધરોએ અને લક્ષ્માધૂસ્વામીજી વગેરે ચૌદ્ધપૂર્વધરોએ પ્રલુના ઉપદેશને આગમણ્ય કર્યો અને તેમાં યુક્તિવાદને વ્યવરિથત ગોઠવ્યો. સાંગ્રહિક ઉમાસ્વાતીજીએ તે પ્રકાશને જીવી ‘તત્ત્વાર્થસ્વત્ત્વ’ની રચના કરી અને તેમાં કહ્યું કે ‘પ્રમાણનૈરરધિગમઃ’ ‘સાચ્યું જ્ઞાન પ્રમાણું અને નયો વડે થાય છે.’ જૈનર્દ્ધનિમંનાં આ રીતે ન્યાયશૈલીથી લખનાર આ પ્રથમ મહાપુરુષ થયા. ન્યાયના પ્રકાશમાં યથેચ્છ વિચારીને સત્યના શોધક અને જૈન ન્યાય-સૂર્યના ઉત્કૃષ્ટ ઉપાસક શ્રી સિક્ષસેન દિવાકર જૈનર્દ્ધનિમંનાં જીવન મહાન નૈયાયિક થયા. તેમણે ‘સન્મતિતર્ક’, ‘ન્યાયાવતાર,’ ‘બત્તીશ બત્તીશાંશો’ વગેરે મહાન ન્યાય અન્શો રચ્યા. પણીથી જીવન નૈયાયિક મહ્યવાદીજ થયા તેમણે ‘નયયકવાદ’ ન્યાયઅન્થ રચ્યો અને બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કરી જૈન ધર્મનો ધ્વજ ફરકાવ્યો. આ રીતે યુક્તિવાદના વિકાસ થતો ગયો અને ન્યાયમાર્ગના પ્રકાશમાં યથેચ્છ વિહરવાની રૂચિ વૃદ્ધિગત થવા લાગ્યી.

વીર નિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીનો સાત સો વર્ષનો સમય જૈન ન્યાય-સૂર્યના ભધ્યાહોનો સમયે હતો એમ કહી શકાય. આ પ્રસ્તુતે તેની આડા બૌદ્ધ, વેદાન્ત વગેરે અનેક વાદળો આવતાં અને ડોાઢ ડોાઢ સમય તે પ્રકાશને ઢાંકી હેવાનો પ્રયત્ન કરતા હતા. આ સાતસો વર્ષ દરમાન જે જે મહાપુરુષોએ તે વાદળો દૂર કરી ન્યાય-સૂર્યને દેશીઘ્રમાન રાખ્યો હતો તેમનો દૂંક પરિચય આપણે આ લેખમાં સાધીશું.

## ૧ શ્રી હરિબદ્ધસૂરિણુ

તેઓનો સત્તાકાળ વિક્રમની છુટી સદીની આસપાસનો છે, જે સમયમાં બૌદ્ધોનું બહુ જોર હતું, અને રાજાઓ વિદ્યામાં રસ લેતા હતા. રાજસભામાં મોટા મોટા શાસ્ત્રાર્થી થતા હતા. બૌદ્ધોએ શર્ન્યવાદ અને તર્કવાદની અતિગૂઠ સમસ્યાઓ જીલી હતી અને તેઓ તે

સમયાચો પોતાના અનુયાયી સિવાય અન્યને સમજવતા ન હતા. આવા સમયે શ્રી હરિલદસુરિજી ઉત્પન્ન થયા હતા.

તેઓ જાતે આલણુ હતા. બૌદ્ધ વિદ્યાના પારંગત હતા. અને સત્ય સમજયા પરી જૈન અન્યા હતા. તેમણે શાસ્ત્રાર્થ કરી બૌદ્ધને હરાયા હતા, અને અનેક જૈન-ન્યાય અન્યાની રચના કરી હતી. તે સમયના બૌદ્ધના જેરનો અને શ્રી હરિલદસુરિજીની પ્રતિલાનો ખ્યાલ નીચેના એક પ્રસંગથી સારી રીતે આવી રહ્કશે.

શ્રી હરિલદસુરિજીના એ ભાણોજ-શિષ્ય હંસ અને પરમહંસ ધર્મા બુદ્ધિશાળી હતા. ન્યાયની પરાક્રાણો પહોંચવાની અને બૌદ્ધન્યાય શિખવાની તેમની ખૂબ ખચ્છા હતી. અનેક વ્યવસાય વગેરેને કારણે શ્રી હરિલદસુરિજી શિક્ષણ આપી શકતા ન હતા, માટે તે બન્ને બૌદ્ધ-સમગ્રહાયમાં શીખવા માટે ગયા. શિક્ષણ લીધા બાદ બૌદ્ધને ખખર પડતાં તે બન્નેને ભરાવી નાખવાનો પ્રયાંધ કર્યો. આ વાતાની એ બન્નેને જણુ થઈ એટલે તેઓ ત્યાંથી ભાગ્યા. એક જણુ વચ્ચેમાં સપદાઈ જવાથી મરણુ પામ્યા, અને બીજા એક હરિલદસુરિજી પાસે આવી પહોંચ્યા અને બધી હકીકત કહી તરત જ સ્વર્ગરથ થયા. જ્ઞાલા શિષ્યોના આમ અકાલ અવસાનથી શ્રીહરિલદસુરિજીને કોધ થયો. બૌદ્ધને શાસ્ત્રાર્થ કરવા આમંત્રણુ મોકલ્યાયું. હારે તે બળતી કડાઈમાં પડે. બૌદ્ધ હાર્યા. આંચાર્થ મહારાજે ૧૪૪૪ બૌદ્ધને મારવાનો સંકલ્પ કર્યો હતો. ગુરુ મહારાજશ્રીના ઉપરેશથી કોધ શાન્ત થયો. અને સંકલ્પ માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેનું પ્રાયશ્રિત લીધું અને તે પ્રાયશ્રિત તરીએ ૧૪૪૪ અન્યાની રચના કરી. હાલ પણ તેમના ઉપરાધ અન્યામાં વિરહ શરૂ આવે છે તે હંસ અને પરમહંસના વિશેગનો સૂચક છે.

તેમના વિરચિત ન્યાયઅન્યો આ છે—૧ અનેકાન્તવાદપ્રવેશ, ૨ અનેકાન્તજ્યપતાકા, ૩ અષ્ટક પ્રકરણો, ૪ ન્યાયપ્રવેશ સૂત્ર—(બૌદ્ધ-ન્યાયના અન્ય પર) વૃત્તિ, ૫ ધર્મસંગ્રહણી, ૬ લખિતવિસ્તરા, ૭ ષડ્દર્શનસમુચ્ચય, ૮ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ( વૃત્તિયુક્તા ). તેમની ભાષા ધર્મા સચોટ છે. હળવે હળવે પણ જે વાત તેઓ બતાવે તે હુદયમાં તરત જ બીતરી જાય છે. દ્વાદશર્દીન દીક્કાર વાચસ્પતિ મિત્રની અને તેમની લખાણ શૈલીમાં સમાનતા ભાસે છે. અનેકાન્તજ્યપતાકામાં સ્થાદાદ્ધનું અનેક યુક્તિ-પ્રયુક્તિઓ પૂર્વક સ્થાપન કર્યું છે. ધર્મસંગ્રહીમાં તેમણે આત્મા તથા ધર્મનો વિષય સુનદર રીતને બતાવ્યો છે, નાસ્તિકોના બૌદ્ધના તથા અન્યોના ભરોનો કર્યો છે. ૫૬૬૮નસમુચ્ચય એકદર માધ્યમિક દશ્ચિંદ્રી લખ્યો છે અને તેમાં ડેવળ છયે દર્શનોની માન્યતા બતાવી છે. છતાં પણ તેમાં જૈનર્દ્ધાર્ણન પ્રત્યેની અલિરુચિ તો વ્યક્ત કરી જ છે. લખિતવિસ્તરામાં સચોટપણે જિનેશ્વર ભગવાનની મહાત્મા અને જૈનર્દ્ધાર્ણનની વિશુદ્ધતા બતાવી છે.

તેમણે પોતાના અન્યોનાં અનેક દાર્શનિક અન્યો તથા અન્યકારોનો ઉલ્લેખ કર્યો છે, તેમાંનાં મુખ્ય આ છે. અવધૂતાચાર્ય, સાંઘ્ય દાર્શનિક આસુરિ અને ચંદ્રરક્ષણ, ગીમાંસક કુમારિલદ, ભાષ્યકાર-પતંજલિ, પાતંજલ યોગાચાર્ય, વૈયાકરણ પાણિની, લગ્નવિદગ્રોપેન્દ્ર, વૈયાકરણ ભર્તુંદરિ, બ્યાસર્વિ, વિન્ધ્યવાસી, શિવધર્મોત્તર વગેરે આલણુ ધર્મિઓ હતા,

કુઝાચાર્ય, દિદ્ધનાગાચાર્ય, ધર્મપાલ, ધર્મકૃતિ, ધર્મોત્તર, અદન્તરદિન, વસુભન્ધુ, શાન્તિરક્ષિત, અને શુભગુપ્ત વગેરે બૌધ્ધભર્મિએ હતા.

અજિતયથા, ઉમાસ્વાતિજી, જિનદાસ મહત્તર, જિનલદગણું ક્ષમાશ્રમણું, હેવવાચક, લદ્રભાડું, મલદ્વારીજી, સમન્તલદ, સિદ્ધસેનદિવાકર, સંધદાસગણું વગેરે આઈત દાર્શનિકા હતા.

વાસવદ્ધતા અને પ્રિયદર્શનાં તથા ઉપર બતાવેલ અન્યકારોના ડેટલાએક અન્યોનો પણ ઉલ્લેખ છે. તેમણે ચૈત્યવાસ સામે જુબેશ ડાહાવી હતી. અને તેમાં પણ ઘણી સુધ્વારણું કરી હતી.

ગ્રે. હર્મન યાડોખીએ ‘સમરાદ્ધકહ્બ’ની પ્રસ્તાવનામાં શ્રીહરિલદસ્રરિજી માટે લખ્યું છે કે-

“હરિલદે તો શૈવેતાભ્યરોના સાહિત્યને પૂર્ણતાની ટોચે પહોંચાયું. જે કે તેમના અન્યો ડેટલાએક પ્રાકૃતમાં છે, પરંતુ ધણ્યાભરા સંસ્કૃતમાં જ છે. આમાં જૈન સમપ્રકાયના પર્વાર્થ વર્ણનું ઉપરાંત વિરોધી ભતવાળા આલખણું તેમજ બૌદ્ધોના સામ્પ્રદાયિક ધોરણો બાબત એક દ્વીપી ખ્યાલ, ડેટલીક ચર્ચા અને તેનાં ખંડનો પણ છે. આ જાતના અન્યોમાં હરિલદસ્રની દિદ્ધનાગના ન્યાયપ્રેશ પરની રીકા, જેકે તે એક પ્રકરણું નથી. પણ, બહુ ઉપરોગી અને મહત્વની છે. જૈનોને પ્રમાણનિરૂપણું નોંધ અન્ય પૂરો પાડવાના હેતુથી સિદ્ધસેન દિવાકરે ‘ન્યાયવત્તાર’ નામનો અન્ય રચ્યો હતો. પ્રમાણણું બાયતમાં જૈન ચિદ્ધાનત સ્થાપવાને બદલે હરિલદે દિદ્ધનાગ ઉપર રીકા લખીને જૈનોને બૌધ્ધ પ્રમાણશાસ્ત્રીએના અન્યાનું અધ્યયન કરવાની પ્રેરણું કરી. આ રીતે દેખાવમાં તો એમણે એ લેડાની ભારે મહત્ત્વાં સ્વીકારી, પરંતુ પોતાના ‘અનેકાંતન્યયપતાક’ અન્યમાં ધર્મકૃતિના પ્રમાણું વિષેના ડેટલાએક સિદ્ધાન્તાનું સાંદું ખંડન પણ કર્યું. એમના પણી ધણ્યાં વર્ષો સુધી જૈનોને બૌદ્ધોના પ્રમાણનિરૂપણમાં રસ રહ્યો હતો. અને એને લિધે જ અત્યારે આપણે ધર્મકૃતિનું ન્યાયબિન્દુ અને ધર્મોત્તરની ન્યાયબિન્દુ—રીકા ઉપલબ્ધ કરી શક્યા છીએ. કારણું કે આ અન્યોની જૂનામાં જૂની પ્રતો અને બીજા અન્ય ઉપરની રીકાનો અમુક લાગ જૈન લંડારોમાંથી જ ભાગેલ છે.”

એક રથે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રી હરિલદસ્રરિજી માટે જણ્યું છે કે: “જ્યારે જૈનદર્શનિરૂપી આકાશમાં પૂર્વિભૂતિ તારાઓને અસ્ત થવાનો પ્રલાત કાળ હતો તે સમયે પદ્મલોચન હરિલદસ્રરિજી ઉત્પન્ન થયા. તેમણે સૂક્ષ્મ દિશિથી તે તારાઓને અવનોક્તા તેના પ્રતિબિન્દુ અહણું કરી અને પ્રકરણોઓ તેનું ગૂંધન કર્યું”

એ રીતે શ્રી હરિલદસ્રરિજી જૈનદર્શનિરૂપી આકાશમાં એક સમર્થ નૈયાયિક થયા અને જૈન ન્યાય આહિત્યની આડે આવતાં વાદળાને વિષેરી નાખી તે સર્થના પ્રકાશને તેમણે ખૂબ પ્રસાર્યો.

## ૨ શ્રી અપ્પભદ્ધસ્રરિજી

તેમનો સત્તાસમય વિકલ્પ સંવત ૮૦૦ થી ૮૫૫ની આસપાસનો છે. તેમના સમયમાં શાલએ પોતપોતાના રાજ્યમાં એક વિદ્ધાન પદિતને રાખતા અને તેમાં પોતાનું ભૂષણ આમજનતા. અપ્પભદ્ધસ્રરિજી બાલકાળથી જ પ્રતિભાસમ્પત્ર હતા. એક વિવસમાં હન્દેર શ્લેષ્ઠા અંકડરથ કરવાની તેમની શક્તિ હતી. આમ રાજ તેમનો પરમ લક્ષ્ય હતો. ધર્મરાજના સલામાં તેમણે બૌધ્ધવાદી વર્ધનકુંજરને જીત્યો હતો, તેથી ‘વાદિકુંજરકેસરી’નું બિરુદ્ધ તેમણે મેળજું હતું. તેમણે મધુરાના વાક્યતિ નામના શૈવયોગીને જૈન અનાયો હતો. તેઓ અખંડ ધર્મચારી હતા, ને તે માટે તેમનો રસનેન્દ્રિય ઉપર ખૂબ કાઢું હતો.

તેમણે યાવનળવ છ વિગર્હ નો ત્યાગ કર્યો હતો. તેમનું અપર નામ લક્ષ્મિરીતિ હતું. તેઓ ‘ખલચારી ગજવર’ અને ‘રાજપૂજિત’ એ એ બિરુદ્ધોથી પણ વિલૂપ્તિ હતા.

### ૩ શ્રી શ્રીલંકાચાર્યજી

તેઓ વિકભના દશમા સૈકામાં થયા. તેઓએ અગિયારે અંગ ઉપર ન્યાય અને આગમ વિચારોથી પૂર્ણ ટીકા લખી છે. જેમાંની હાલમાં આચારાંગ અને સુયગડાંગ પરની વૃત્તિ ઉપલબ્ધ છે. જુવસમાસ ઉપર તેમણે ટીકા લખી છે. લાઘ્વકાર શ્રી જિનલક્ષ્મિશ્રી શ્રમા-અભણુવિરચિત ‘શ્રી વિશેખાવખ્યકાદ્ય’ ઉપર તેમણે વૃત્તિ લખી છે. આ ટીકા, તેમનું ખીંચું નામ ડોઓચાર્ય હતું તે નામથી પ્રસિદ્ધ છે.

અંગો ઉપર ન્યાયશૈલીથી ટીકા લખનારાઓમાં શ્રીલંકાચાર્ય પ્રથમ છે.

### ૪ શ્રી સિદ્ધબિંસુરિણુ

સિદ્ધબિંસુરિણો સત્તાસમય વિ. સં. ૮૬૨ની આસપાસનો છે. કારણું કે તેમણે બનાવેલ ઉપમિતિભવપ્રાપ્તાની નામની કથા ૮૬૨માં પૂર્ણ થઈ છે. સિદ્ધબિંસો સમયમાં પણ બૌદ્ધાનું વિરોધ નેર હતું. દીક્ષા લીધા બાદ તેઓ બૌદ્ધો પાસે<sup>૧</sup> અભ્યાસ કરવા ગયા હતા. ત્યા તેમને બૌદ્ધ સિદ્ધાન્ત રુચિ ગયા, પરંતુ વચ્ચનાંદ્ય થયા હોવાથી ગુરુ મહારાજ પાસે આવ્યા. વળી ત્યા વચ્ચન આપીને આવ્યા હોવાથી ત્યા ગયા, કરી અહીં આવ્યા. એમ એકવીશ વખત બન્યું હતું. છેવટે શ્રી હરિલદસુરિણુની અને ‘લક્ષ્મિતવિસ્તાર’ વાંચી નૈનદર્શનમાં સ્થિર થયા હતા. તેમણે શ્રી હરિલદસુરિણુની અને ‘લક્ષ્મિતવિસ્તાર’ની ખૂબું પ્રશંસા લખી છે. ‘ઉપમિતિ’ની પ્રશસ્તિમાં તેઓ લખે છે કે ‘એ હરિલદે પોતાની અચિન્ત્ય શક્તિથી મારા-ભાંથી કુવાસનાસ્ય જેર ફૂર કરીને, કૃપા કરી સુવાસનાશ્ય અમૃત મારા લાલ માટે શોધી કાઢ્યું છે તે હરિલદસુરિને મારા નમસ્કાર હો ! તે હરિલદસુરિણુને મારા નમસ્કાર હો કે નેમણે મારા માટે ‘લક્ષ્મિતવિસ્તાર’ નામની વૃત્તિ રચી.૨’

તેઓ છેં દર્શનના વિદ્ધાન હતા. તેમણે સ્વયં લખ્યું છે કે ‘કૃતિરિયે જિનજૈમિ-નિકળભુક્ષસૌગતાદિવર્દ્ધનવેદિનઃ સકલગ્રનથાર્થનિપુણસ્ય શ્રીસિદ્ધબેર્મહાચાર્યસ્વેતિ।’ તેમણે સિદ્ધસેનકૃત ‘ન્યાયાવતાર’ ઉપર વૃત્તિ રચી છે.

### ૫ શ્રી પ્રધુભનસુરિણુ

તેઓ વિકભની ૧૧ મી સદીમાં થયા છે. તેઓ એક સમર્થવાદી હતા<sup>૩</sup> અલ્યુ રાજની રાજસ્થાલામા તેમણે છિગમ્બરાને પરાજ્ય આપ્યો હતો. ઐનિલુવનગિરિ અને સપાહલક્ષ (માલવા) આદ્ધિના રાજનોને જૈન બનાવ્યા હતા અને ૮૪ વાહો જીતીને આનન્દિત કર્યા હતા.

૧. સિદ્ધબિંસુ ન્યાયાં તર્કશાસ્ત લાણુવા ગયા હતા તે નગરસું નામ ‘મહાયાદ્ય’ લખ્યું છે. તે નગર કથાં હતું તેનો કંઈ પત્તો લાગતો નથી પણ તે સ્થાન તક્ષણિતાનું વિક્ષેપિતાદ્વારા અથવા નાંદ્ધા વિક્ષેપિતાદ્વારા એ જેમાંથી એક હોંઠ જોઈએ એમ લાગે છે.

૨ નમોડસુ હરિભદ્રાય, તસ્મૈ પ્રવરસ્યા । મર્દદ્ય નિર્મિતા યેન, વૃત્તિલલિતવિસ્તાર ।

૩ વાં જિત્વાડલ્લુકસ્માપસમાયાં તલ્પાટકે । આતૈકપદો યસ્તં શ્રીપ્રયુદ્ધં પૂર્કં સુવે ।

—( સમરાહિત્યસંક્ષેપ )

૪ સાદલક્ષણોપાલ—શ્રીમુવનગિર્યાર્મિદેશગોપાલાન् । યયુશ્ચતુરધિકાશોત્ત્યા, વાદગ્ની રઙ્ગચામાસ ।

—( પાર્થીનાથમન્ત્રિ )

### ૬ તર્કપંચાનન શ્રી અભયહેવસ્તુરિજી

તેમનો સત્તાસમય વિકલ્પની ૧૧ મી શતાબ્દિ છે. તેઓ એક સમર્થ દીકાર હતા. તેમણે શ્રી સિદ્ધસેન દિવાકરળના 'સન્મતિતર્ક' ઉપર ૨૫ હજાર રૂપોક પ્રમાણુ વિસ્તૃત ટીકા રચી છે. તેમાં દશમી શતાબ્દિ સુધીના આલુ સર્વ વાહાની સુન્દર રીતને જોડવણુ કરી છે. તે દીકારનું નામ 'વાદમહાર્ષીવ' અથવા 'તત્ત્વાધ્યવિદ્યાધીની' છે. તેમની વાદ લખવાની પ્રકૃતિ ધાર્ષી જ મનોજ છે. પ્રથમ આલુ સિદ્ધાન્તમાં બિલકુલ નહિ માનનાર પક્ષ પાસે ખોલાવે, પછી કંઈક સ્વીકાર કરનાર પાસે તેનું ખંડન કરાવે ને તેનો મત પ્રદર્શિત કરાવે, પછી વધુ માનનાર પાસે, પછી ધાર્ષું સ્વીકાર કરનાર પાસે ને છેવટ સર્વમાં દૂષણુ ખતાવવા. પૂર્વક સ્વાભિમત સિદ્ધાન્તનું મંડન કરે. તે વાંચતા જણે એમ લાગે કે આપણે સાક્ષાત એક વાદસલામાં જ હોએછે અને પ્રત્યક્ષ વાદ સંબળતા હોએછે.

ર્દ્દીનશાસ્ત્રોમાં ભીમાંસા ર્દ્દીન સમજવું સુશ્કેલ હોય છે, તે ભીમાંસા ર્દ્દીનના આકર અન્ય કુમારિલ લઈના 'શ્લોકવાર્તિક'નું આ 'વાદમહાર્ષીવ'માં વિરોધ ખંડનમંડન છે. તેથી આ અન્ય સમજવો ધણેણ કહિન ગણ્ય છે. ને તે જ કારણે અભ્યાસમાં અદ્ય આવ્યો છે. શાન્તિરક્ષિત ડે જેઓ. નાલના વિશ્વવિદ્યાલયના સુખ્ય આચાર્ય હતા તેમના બનાવેલ 'તત્ત્વ-સંગ્રહ' ઉપરની કમલશીલની બનાવેલ 'પર્જિકા' નામની ટીકા, દિગ્ંઘરાચાર્ય પ્રલાયદે રચેલ 'પ્રેમેયકમલમાર્તીર્દ' તથા 'ન્યાયકુમુદયદ્રોદ્ય' વગેરે અન્યોનો આ ટીકામાં ઉપયોગ છે. વાદ દેવસ્તરિજી, મહિલષેષુસ્તુરિજી તથા ઉપાધ્યાય શ્રી ધરોવિજયજી વગેરાએ સ્થળે સ્થળે આ ટીકાનો ઉલ્લેખ તથા છૂટથી ઉપયોગ કર્યો છે. ૧૧ મા સૈકા પછી જૈન ન્યાયના મોટા મોટા અન્યો રચાયા તે સર્વમાં આ ટીકાની સહાય લેવામાં આવી છે. આ ટીકામાં ગૂંઘાયેલ વિષયો પાછળના અન્યકારોને સરળતાથી મળી ગયા છે. આ ટીકામાં શરૂઆતની અહુ રમકુઝમક નથી પણ ભાષાપ્રવાહ એક નિર્મણ જરણું માફક સીધે વહે છે. પ્રો. લોયમેને શ્રી અભયહેવસ્તુરિજીના સમ્બન્ધમાં જણ્ણાબું છે જે 'તેમનો ઉદેશ તે સમયમાં પ્રચલિત સર્વ વાહાનો સંગ્રહ કરી અનેકાન્તવાદનું સ્થાપન કરવાનો હતો'-તે આ ટીકા જોવાથી સપ્ટ સમજય છે. શ્રી અભયહેવસ્તુરિજી, 'ન્યાયવનસિંહ' અને 'તર્કપંચાનન' એ બિરુદ્ધોથી વિભૂષિત હતા, અને ૮૪ વાદવિજેતા. શ્રી પ્રધુમનસ્તુરિજીના પદપ્રલાવક હતા.

### ૭ શ્રી ધનેશ્વરસ્તુરિજી

તેઓ મુંજરાળના સમયમાં થયા એટલે તેમનો સત્તાકાળ ૧૧ મી વિકલ્પ શતાબ્દિનો હતો. તેઓ તર્કપંચાનન શ્રી અભયહેવસ્તુરિજીના પદ્ધતર હતા. ધારાનગરીના સાર્વલૌભ રાજ મુંજે તેઓને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્ય હતા. તેમણે રાજની સલામાં અનેક વાહો અત્યા હતા. પ્રવચનસારોક્ષાર-વૃત્તિમાં શ્રી સિદ્ધસેન લખે કે—

તદ્દનુ ધનેશ્વરસ્તુરિજો, ય: પ્રાપ પુંડરીકાલ્ય: ।

નિર્મથ્ય વાદજલધિ, જયશ્રિય મુંજનૃપુરતઃ: ॥

### ૮ વાદવિતાલ શ્રી શાન્તિસ્તુરિજી

'પ્રલાવકચરિત'માં તેમનો સ્વર્ગવાસસમય વિ. ૧૦૬૬ ના એટ સુદ ૬ ને ભાગળવાર, ઇતિકા નક્ષક, જણ્ણાવેલ છે. તેમના પ્રત્યે પાઠણુના લીમરાળને અને ધારાનગરીના લોજ-

રાજને ધર્મ માન હતું. તેથા લીમરાજની સલામાં ‘ક્રીન’ અને ‘વાહિયકૃતી’ તરીકે વિખ્યાત હતા અને મહાકવિ ધનપાલની પ્રેરણાથી બોજરાજની રાજસભામાં ગયા હતા. બોજરાજને પોતાની સલા માટે અલિમાન હતું. તેણે શાન્તિસુરિજીને શરતપૂર્વક કહ્યું હતું કે મારી સલાના ‘એક એક વાહિની જીતમાં એક એક લક્ષ દ્રવ્ય આપીશ. શાન્તિસુરિજીએ બધાં દર્શનેના ચોરાશી વાદીઓને તેની સલામાં જતી ૮૪ લક્ષ દ્રવ્ય ધર્મમાર્ગમાં વપરાયું હતું. અને બોજરાજે તેમને ‘વાહિવેતાલ’ એવું બિરુદ્ધ આપ્યું હતું. તેમણે એક ધર્મ નામના પદ્ધિતને પણ જીત્યો હતો અને દ્રવિડ દેશના એક અધ્યક્તવાદી અલિમત્ત પદ્ધિતને પરાજય આપી ગરીબ પણ તુલ્ય કરી દીધો હતો.

તેઓની પાસે બનીશ શિષ્યો પ્રમાણુશાખનો અભ્યાસ કરતા હતા. એકદા એક કંઈન વિષય ૧૬ દિવસ સુધી શિષ્યોને સમજવનું છતાં જ્યારે કોઈ પણ શિષ્યને તે વિષય ન સમજયો ત્યારે તેમને દુઃખ થયું. તે સમયે વાદી દેવસુરિના ગુરુ મુનિયદ્રસ્થરિ ત્યાં જઈ ચડ્યા હતા. અને તેમણે તે સર્વ વિષયનું વિવેચન અપ્રકટપણે ધ્યાન રાખી કહી આપ્યું હતું. તે સમયે શાન્તિસુરિજીએ કહ્યું ‘હતું કે ‘તમે તો રેણુથી આચળાદિત રત્ન છો. હે વત્સ ! હે સરળમતિ ! મારી પાસે પ્રમાણુશાખનો અભ્યાસ કર અને આ નશ્વર દેણો. અહીં લાલ લઈ લો ! ’ પછીથી ટક્કશાળના પાછળના લાગમાં તેમને રહેવાની સગવડ કરાવી છે દર્શનનો અભ્યાસ કરાવ્યો હતો.

તેમની ન્યાય લખવાની શક્તિ અપૂર્વ હતી. તે વિષયમાં તેમની અનાવેલ ઉત્તરાધ્યયન જુહ્ફાતિ ( પાઈઠીકા ) પુષ્ટિ આપે છે. ટૂંકમાં સચોટપણે લખવું એ એમની લેખન શૈલીની વિશિષ્ટતા છે. આ ટીકાને આધારે વાદ દેવસુરિજીએ સિદ્ધરાજની સલામાં દિગ્ભર વાદી કુમુખન્દને પરાજય આપ્યો હતો. ‘જીવવિચારપ્રકરણ’ અને ‘શૈલ્વદ્વાનમહાબાપ્ય’ના કર્તા પણ આ જ શાન્તિસુરિજી હશે કે બીજા ? તે વિચારણીય છે. તેમના ગુરુનું નામ વિજ્યસિંહસુરિજી છે.

#### ૯ શ્રી જિનેશ્વરસુરિજી

તેમનો સમય ૧૦૮૨ થી ૧૦૯૫ ની આનુભાનુનો છે, કારણ કે તેટલા સમયમાં અનાવેલ તેઓના અન્યો વિવિધમાન છે. તે સમયે પાટણુના તપ્ત પર હુર્મભરાજ રાન્ય કરતો હતો. તેની સલામાં તેઓનું સાંન માન હતું. તેઓએ શ્રી હરિબદ્રસ્થરિજીના ‘અષ્ટક પ્રકરણ’ ઉપર વૃત્તિ રચી છે, જે અનેક ન્યાયવિચારણી પૂર્ણ છે. તેમાં શુદ્ધ દેવ, મૂર્તિપૂજા, મુજિ વગેરે ધાર્યા વિષયો તર્ક દર્શિથી ચર્ચા છે. અને ‘પ્રમાણુલક્ષણ’ નામનો ન્યાયઅન્ય સ્વોપ્નવૃત્તિ સહિત રચ્યો છે.

#### ૧૦ શ્રી સ્વરાચાર્યજી

તેમનો સત્તાસમય ૧૧ મી સદીનો છેવટ લાગ અને ખારમી સદીની શરૂઆત છે. તેઓ શાધ્યશાખ, પ્રમાણુશાખ તથા સાહિલ્યશાખ વગેરેમાં નિપુણ હતા. પોતાની શક્તિ માટે તેમને માન હતું. તેમની પાસે અનેક શિષ્યો અભ્યાસ કરતા હતા. તેમનો તાપ અપૂર્વ હતો, શિષ્યની ભૂલ થાય કે તરત જ માર પડતો. અને એમ થતાં હંમેશ એધામાં રાખવાની લાકડાની એક દાંડી તૂટી જતી હતી. ગુરુમહારાજના મર્મ વચનથી બોજરાજની સલામાં

આ હતા અને સર્વ પડિતો ઉપર વિજય મેળવ્યો હતો. પ્રથમ તો બોજરાણ તેઓના છિપર પ્રસંગ થયો. હતો ફલુ પાછળથી તેઓના નમ સત્ય કહેવાના સ્વભાવથી કોષિત થયો હતો. બોજરાણ સર્વ દેર્શનોને એકઠાં કરવાનો પ્રયત્ન કરતો હતો. તે ન થઈ શકે તેમ તેમણે તેને સંમનાબુનું હતું. બોજવ્યાઠરણમાં ભૂલો બતાવી હતી. છેવટે બોને તેમને દેહકષ્ટ આપવા વિચાર કર્યો હતો, પરંતુ ધનપાતની ગોડવણુથી તેઓ સુધે પાટણું પહોંચ્યી ગયા હતા. ‘નેમિનાલેય-દ્વિસંધાન મહાકાબ્ય’ તેમની કાવ્યકૃતિ છે. ભીમહેવની સભામાં તેમનું સાંકુ માન હતું. ભીમહેવના મામા પ્રોણુથાર્યના તેઓ શિષ્ય હતા અને સંસારપક્ષે અત્રીજ હતા.

## ૧૧ નવાંગીદીકાકાર શ્રી અભિયાનસુરિલુ

સંવત ૧૦૮૮ માં ૧૬ વર્ષની વયે તેમને આચાર્ય પદ મળ્યું હતું અને તેમનો સર્વજીવાસ ક્ષે. ૧૧૩૬ની લગભગ થયો હતો, એટલે તેમનું આચુષ્ય આશરે ૬૭ વર્ષનું થયું. જૈન આગમો ઉપર સીધાંકાચાર્યાદ્કૃત અગિયાર અંગમાંથી આદિનાં એ અગોની જ ટીકા મળતી હતી. તેથી તેમણે હૈવી પ્રેરણુથી નવ અંગ ઉપર ટીકા રચી હતી. જિનેશ્વરસુરિલુકૃત ‘ધ્યાનકલાભ’ ઉપર તેમની ટીકા છે, હરિલદ્ધસુરીશ્વરજીના ‘પંચાશક’ પર તેમની ટીકા છે. અનેક ગ્રન્થોનું દોહન ભરી વૃત્તિ રચવાની તેમની શૈલી અધૂર્વા છે. આજ પણ નવ અંગપરની તેમની ટીકા અનેક વિશ્વારણુઓને વેગ આપે છે.

સ્તંબનપાર્શ્વનાથજીની પ્રતિમા તેમના જ આત્મભળે અને પુષ્યપ્રભાવે પ્રકટ થયેલ છે. તે સમયે તેમનું અનાવેલ ‘જગતિહુઅણુ’ સ્તોત્ર આજ પણ ગ્રાલાવિક મનાય છે. તેમની વ્યાખ્યાન અને વિવેચન કરવાની શક્તિ અદ્ભુત હતી. એક સમય ‘અમ્ભરન્તર’ એ ‘અજિતશાન્તિસ્તવ’ની ગાથાનું શુંગારિક વિવેચન કરતાં તેમના પર એક રાજકુમારી મોહિત થઈ હતી. પણીથી વૈરાગ્ય અને શાન્તરસના ઉપદેશથી તેઓએ તેને પ્રતિબોધિત કરી હતી. તેમની સર્વ ટીકાઓ ૧૧૨૦ થી ૧૧૨૮ સુધીમાં રચાયેલ છે. તેઓનો સર્વજીવાસ કૃપદ-વંજમાં થયો છે.

## ૧૨ શ્રી ચંદ્રપ્રભસુરિલુ

સં. ૧૧૪૮ માં તેઓ વિદ્વમાન હતા. તેમણે ‘દર્શનશુદ્ધિ’ અને ‘પ્રમેયરણ ડોષ’ એ એ ન્યાયગ્રન્થો રચ્યા છે.

## ૧૩ શ્રી ભીશચાર્યાદ્લુ

તેઓ વિકભની ૧૨ શતાબ્દિના ઉત્તરાર્ધમાં થયા. પાટણના સાર્વલૌભ રાણ સિદ્ધરાણને સેમના પ્રત્યે બહુ માન હતું. એક વખત રાણએ મશકરીમાં તેમને કહું કે ‘અમારા જેવા રાણના આશ્રયથી આપશી દીપો છે !’ આના પ્રત્યુત્તરમાં આચાર્યશ્રીએ જણાયું કે ‘પૂર્વ પુષ્યથી પ્રતિબા પ્રસરે છે.’ રાણએ વળી કહું: ‘આ સભા સિવાય અન્ય દેશમાં ફરશો ત્યારે બીજા બાવાની જેમ અનાથતા સમજશે.’ સરિલુએ કહી દીધું કે ‘અસુક સમયે પોતે અહીંથી વિહાર કરશે. સિદ્ધરાણે નગરદારો બંધ કરાયાં. વિદ્યાભાગથી આચાર્યશ્રી બઢાર નિકળીને પદ્ધતિપુર પહોંચ્યા, લાંથી મહાણોધ નગરમાં જરૂર પૌછોને વાદમાં હરાવ્યા. ગોપાલ-ગિર ( ગવાલિયર ) માં રાણએ ધારું સન્માન આપ્યું ને ત્યાં પણ અન્ય વાદીઓને જીત્યા, રાખ્યે ચામર છત વગેરે રાજચિહ્નો આપ્યાં. નાગોર જરૂર કૈનદર્શનની રેખાબા વધતી

સિદ્ધરાજના આમંત્રણુથી પુનઃ પાઠણ તરફ વિહાર કરો. ચારુપ આવ્યા ત્યારે તેમને મળવા સિદ્ધરાજ લાં આવ્યો હતો. પાઠણમાં એક સાંખ્યવાદી વાવિસિહ આવ્યો હતો. સિદ્ધરાજે તે વાદને હરાવવા ગોવિદાચાર્ય કે જેઓ કર્ણ મહારાજના બાલમિત્ર હતા અને વીરાચાર્ય-જીના કલાશુદુ હતા, તેમને વિનિતિ કરી. તેઓએ કહ્યું કે તેને તો વીરાચાર્યજી હરાવશે. પછીથી વીરાચાર્યજીએ ગોવિદાચાર્યજી સાથે જઈ તેનું સર્વ માન ગાળી નાખ્યું હતું. તે વાદમાં વીરાચાર્યજી પોતાનો પક્ષ મતમપૂર છન્દ અને અપહૂનુતિ અલાંકારમાં ઓલ્યા હતા. સર્વાનુવાદી શરત પ્રમાણે સાંખ્યવાદી તે પ્રમાણે ઓલી શક્યો ન હતો. એ પ્રમાણે વીરાચાર્યજી વિજયમાળ વર્ણ્ણ હતા. વળી સિદ્ધરાજની સભામાં કમલકર્તિની નામના દિગ્ભરવાદીને હરાજી સ્વીમુક્તિની સિદ્ધિ કરી હતી. અને વિજય મેળવ્યો હતો.

#### ૧૪ શ્રી મુનિઅંદ્રસૂરિજી

તેમનો સ્વર્ગવાસ વિ. સંવત ૧૧૭૮ માં થયેલ છે, એટલે તેઓ વિકલ્પની બારભી શતાંધિમાં થયા. તેઓ આખંડ ઘણ્યારી અને ઉચ્ચ તપસ્વી હતા. તેઓ કંળ પીને જ રહેતા તેથી ‘સૌવીરપાયી’ તરીક પ્રસિદ્ધ થયા હતા. શ્રી હરિભદ્રસૂરિજીકૃત ‘અનેકાન્તજ્યપતાકા’ પર ટિપ્પન અને ‘લલિતવિસ્તરા’ પર પંજિકા, વગેરે તેમની ન્યાયરચના છે. બીજ પણ કુલ્કા, વૃત્તિએ, પ્રકરણો, વગેરે લગભગ ૨૦ થી ૨૫ અન્ધે તેમણે રચ્યા છે. તેઓ વાદનિપુણું હતા. ‘મુદ્રિતકુમહચંદ્ર’ નાટકમાં તેમણે અર્થોરાજની સભામાં એક શૈવવાદીને જીત્યો હતો તેમ ડલ્લોખ છે. તથા ગુણચંદ્ર નામના દિગ્ભર મહાવાદી સાથે વાદ કરવાનો હતો તે સમેયે વાદ દેવસૂરિજી તેમની સાથે હતા ને તેમની શૈશવ વંય હતી. તે વખતે તે વાદને દેવસૂરિએ જીત્યો હતો. વાદ દેવસૂરિજીના તેઓ ચુરુ હતા.

#### ૧૫ શ્રી ચન્દ્રસૂરિજી

તેમનો સત્તાસમય ૧૧૬૬ ની આસપાસનો છે. મુનિઅવરથામાં તેઓ ‘શ્રી પાર્શ્વહીંગિ’ એ નામથી પ્રસિદ્ધ હતા ને આચાર્ય થયા પછી શ્રી ચંદ્રસૂરિજી કહેવાયા. તેમણે બૌધ્ધાચાર્ય દિક્ષિનાગકૃત ‘ન્યાયપ્રેશક’ પર કે હારિભદ્રીજીતિ છે તે પર ‘પંજિકા’ રચી છે. અન્યાન્ય વિષયોના અન્ધે પર વૃત્તિ, ટીકા, વ્યાખ્યા તેઓએ સારી રચી છે.

#### ૧૬ ભલધારી શ્રી હેમચન્દ્રસૂરિજી

તેઓ બારભી સદીના અંતની લગભગમાં થયા. એમના ચુરુ ભલધારી અભયદેવસૂરિજી છે. પૂર્વવસ્થામાં તેઓ પ્રદ્યુમન નામના રાજમંત્રી હતા. તેમની વ્યાખ્યાનશક્તિ અધ્યુર્વ હતી. સિદ્ધરાજ જ્યસિહ કલાકોના કલાકો સુધી તેમના વ્યાખ્યાનમાં ઐસતો અને ડેટલીક વખત સાંભળવાની ડલ્કંઢાથી એકલો તેમની પાસે આવતો. અમુક સ્થળ સુધી સિદ્ધરાજ જ્યસિહ તેમની સમશાનયાત્રામાં ગયો હતો તેથી સમજ શકાય છે કે સિદ્ધરાજને તેમના ઉપર ધાર્યું જ માન હતું. તેઓએ એક લાખ શ્લેષ્ટ પ્રમાણુ વર્વિભ અન્ધેની રચના કરી છે. તેમાં ન્યાયઅન્ધ તરીક ગણ્યાવી શકાય તેવી વિરોધાવશ્યકપરની ઘણ્યવૃત્તિ છે. તેનું પ્રમાણુ ૨૮ હજાર શ્લેષ્ટ જેટલું છે. ગણ્યધરવાદ, નિહિતવાદ, શાખદ, નય, નિક્ષેપ, રાન વગેરે અનેક વિષયો તેમાં ન્યાયશૈલીથી સારી રીતે ચર્ચ્યા છે. આર્હતદર્શનના મૌલિક વિચારોનું તર્કપદ્ધતિમય સ્વરૂપ આ ટીકામાં મળે છે. એ ટીકામાં ૧ અભયકુમાર ગણ્ય, ૨ ધનદેવગણ્ય,

૩ જિનલદ્રગણિય, ૪ લક્ષમણુગણિય, ૫ વિલુધવંદ્રમુનિ, એ પાંચ મુનિઓએ અને આણુંદ્રીજી તથા વસુમતિશ્રીજી એ એ સાધીઓ, એમ સાત જણે મદદ કરી હતી.

### ૧૭ વાદી દેવસૂરિલ

તેમનો જન્મ સં. ૧૧૪૩ માં મહાઙૃત ગામમાં થયો હતો. તે ગામ આણુની આસપાસ આવેલ છે. ૧૧૫૨ માં દીક્ષા, ૧૧૭૪ માં આચાર્યપદ, અને ૧૨૨૬ માં શ્રા. વ. ૭ ને શુરૂવારે તેઓ સ્વર્ગરસ્થ થયા. તેમના શુરૂ સુનિયદ્રસ્તરિજી શાન્તિસ્તરિજીના જ્ઞાનઅજનનાના વારસદાર હતા. તેમણે વાદી દેવસૂરિલને પ્રમાણ વગેરે શાસ્ત્રનો સારો અભ્યાસ કરવ્યો હતો. દીક્ષા દીક્ષા બાદ એ-પાંચ વર્ષમાં જ તેમની ઘ્યાતિ ચોતરફ પ્રસરી ગઈ હતી. તે સમયમાં તેમણે બન્ધુ નામના શૈવદર્શની દૈત્યવાદીને ધોળકામાં જીત્યો, સાચોરમાં વાદ કર્યો ને જીત્યા, શુણુંદ દિગ્ભરને નાગોરમાં પરાજિત કર્યો. લાગવત શિવભૂતિને ચિતોડમાં, ગંગાધરને જવાલીયરમાં, ધરણુધરને ધારામાં, કૃષ્ણ નામના વાદીને ભર્યમાં, એમ અનેક વાદીઓ ઉપર જીત મેળવી હતી.

આચાર્ય થયા પછી તેમણે સિદ્ધરાજની સભામાં દિગ્ભર મહાવાદી કુમુદચંદ્રને વાદમાં હરાવ્યો હતો. કુમુદચંદ્રનો તે સમયે પ્રથમ પ્રતાપ હતો. પોતાની શક્તિ માટે એને ખૂબ અભિમાન હતું, ૮૪ વાદી તેણે જીત્યા હતા. વાદીદેવસૂરિજી સાથે વાદ કરવાની તેને ખૂબ ધૂંછા હતી. દેવસૂરિજી તેવા તુચ્છપ્રકૃતિના વાદી સાથે વાદ કરવા ધૂંછા ધરાવતા ન હતા, પરંતુ જ્યારે તે દિગ્ભરે અનેક નાગાર્ધ કરી, છેલ્લે શ્વેતાંભર મતની સાધીની છેડતી કરી એટલે દેવસૂરિજીએ વાદનું આભંતણું આપીને વાદ કર્યો. તે વાદમાં મુખ્યપણે ડેવાની-ભુક્તિ અને સ્વી-ભુક્તિ એ એ વિષયો ચર્ચાયા હતી. શરત પ્રમાણે વાદમાં હાર થવાથી દિગ્ભરેને ગુજરાત છાડી ચાલ્યા જતું પડ્યું હતું. આ વિજય બાદ તેઓ ‘વાદી દેવસૂરિજી’ એ નામથી વિખ્યાત થયા. આ વિજયથી સિદ્ધરાજે તેઓશ્રીને વિજયપત્ર અને એક લાખ સુવર્ણભુદ્રાઓ અર્પણું કરી હતી. મુનિધર્મના આચાર પ્રમાણે તે એક લાખ સુવર્ણભુદ્રાઓ અહણું કરી ન હતી. મહામંત્રી આણુકની સંમતિથી તે મુદ્રાઓનો બ્યય કરી સિદ્ધરાજે એક જિનપ્રાસાદ બંધાંયો હતો. તેમાં શ્રી આદિનાથના બિમની ૧૧૮૩ ના વૈશાખ શુક્લ દ્વાદશીને દ્વિતી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમાં ચાર આચાર્યો સમાચિત હતા. તેમના આ વાદની અનેક આચાર્યોએ સુનંદર પ્રશાંસા કરી છે. તેમાં તે સમયે હેમચંદ્રસૂરિજી લાં વિદ્યમાન હતા, તેમણે ‘શ્રી સિદ્ધહેમવ્યાકરણ’માં લખ્યું કે-

યदિ નામ કુમુદવન્દ્રં, નાજેષ્યદ્વ દેવસૂરિરહિમહુચિ: ॥  
કટિપરિધાનમધાસ્યત, કતમઃ શ્વેતાંભરો જગતિ? ॥

‘ને દેવસૂરિજી ઇથી સર્વે કુમુદચંદ્રને ન જીત્યો હોત તો જગતમાં કર્યો શ્વેતાંભર કટિપર વખતે ધારણું કરત ?’

આ સિવાય રત્નપ્રભસૂરિ, મહેશ્વરાચાર્ય, સોમપ્રભસૂરિ, ઉદ્યપ્રભહેવ, પ્રબુભ્નાચાર્ય, મુનિદેવસૂરિ, સોમચંદ્ર પંડિત, મેરુતુંગાચાર્ય, મુનિલદ્રસૂરિ, શુણુરતસ્સરિ, મુનિસુનંદરસૂરિ, ધર્મસાગર ઉપાધ્યાક વગેરેણે અનેક સ્થળે આ વાદને માટે સ્તરિજીની અનેક પ્રકારે પ્રૌદી

કર્તૃની વિષ્યાતિ કરી છે. યશશ્વરન્દે તો આ વાદના સમ્પૂર્ણ પ્રસંગનું વર્ણન આપતું ‘મુનિતિકુમુદચન્દ’ અકરણ રચ્યું છે, જે ધારું રોચક છે.

તેમનામાં અન્યરચનાની શક્તિ પણ અદ્ભુત હતી. તેઓએ જૈન ન્યાયના પ્રવેશ માટે ઉપયોગમાં આવે તેવો ઉજ્ઞસુન પ્રમાણું ‘પ્રમાણુન્યતત્વાલોકાલાકાર’ નામનો ન્યાયનો ભૂલભન્થ આઠ પરિચ્છેદમાં રચ્યો છે. તેના પર તેઓશ્રીએ જે ‘સ્યાદાદરતનાકર’ નામની વિસ્તૃત વૃત્તિ લખી છે, તેનું પ્રમાણ ૮૪૦૦૦ હજાર શ્લોક જેટલું છે. તેમાં દાર્શનિક વિષ્યોનું સુનદર ખંડનમંડનાત્મક સ્વરૂપ છે. જે કે તે વૃત્તિ હાલમાં સમ્પૂર્ણ ઉપલબ્ધ નથી તો પણ જેટલી ઉપલબ્ધ છે તેટલી સારી રીતે પ્રકાશમાં આવેલ છે. તે વૃત્તિનું કાઢિન્ય પણ ધારું સમજાયેલ છે. તેમાં પ્રવેશાર્થી તેમના શિષ્ય રત્નપ્રભસ્સરિજીએ ‘રત્નાકરાવતારિકા’ નામની લધુ વૃત્તિ ભૂલસ્થળ પર રચ્યો છે. તેમાં ‘સ્યાદાદરતનાકર’ની ખૂબ ગંભીરતા બતાવી છે. તેઓએ તથા અન્ય આચાર્યાએ ‘સ્યાદાદરતનાકર’ના ધારું વધાણ કર્યા છે. ‘સ્યાદાદરતનાકર’ની રચનામાં વાદ દેવસ્સરિજીના એ શિષ્યો લદ્રેક્ષરસ્સરિ અને રત્નપ્રભસ્સરિજીએ સહકાર આપ્યો હતો. આ માટે તેઓએ જ લઘું છે કે-

કિં દુષ્કરં ભવતું તત્ત્વ મમ પ્રબન્ધે, યત્ત્રાતિનિર્મલમતિઃ સતતામિશ્રુકઃ ।

મદ્રેશ્વરઃ પ્રવરસ્તકિસુધાપ્રવાહો, રત્નપ્રભશ્ચ ભજતે સહકારિભાવમ् ॥

### ૧૮-૧૯ શ્રી અમરચંદ્રસ્સરિજી અને શ્રી આનંદ્સ્સરિજી

આ બન્ને આચાર્યો વિકભની બારમી સહિતી સહામાં થયા. તેમણે સિદ્ધરાજની સહામાં બાધ્યાવરસ્થામાં જ વાદીએને હરાદી વિજ્ય મેળન્યે હતે, તેથી સિદ્ધરાજે તેઓને અનુકૂળે ‘સિંહશિશુક’ અને ‘બાધશિશુક’ એવાં બિરુદ્ધ આપ્યાં હતાં. શ્રી અમરચંદ્રસ્સરિજીએ ‘સિદ્ધાન્તાર્થ્યવ’ નામનો અન્ય રચ્યો છે. ડા. શતીશચંદ્ર વિદ્યાભૂતણું, ઉપરના એ બિરુદ્ધે આધારે-મહાતાર્કિંગ ગંગેશોપાધ્યાએ ‘તત્ત્વચિન્તામણિ’ નામનો નબ્યન્યાયનો મહાઅન્થ રચ્યો છે, તેમાં વ્યાભિચરવરૂપ પર લખતાં વ્યાપ્તિનાં એ લક્ષ્ણેનું નામ ‘સિંહ-બાધ લક્ષ્ણુ’ એવું આપ્યું છે, કદાચ તે એ લક્ષ્ણે ઉપરોક્તા એ મહાતાર્કિંગાની માન્યતાનાં હોય,—એમ અભિપ્રાય બતાવે છે.

### ૨૦ શ્રી દેવલદસ્સરિજી

આ આચાર્ય બારમી સહિતે આતે થયા. તેમણે ‘ન્યાયાવતાર’ પર દ્વિપણ રચ્યું છે, મુનિચંદ્રસ્સરિજીથી તેઓએ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. પોતાના શુરુ શ્રીચંદ્રસ્સરિજીની ‘સંગ્રહણી’ પર વૃત્તિ રચ્યી છે. તેમાં નીચેના અન્યોનાં ઉલ્લેખ અને અવતરણો આપ્યાં છે: ‘અનુયોગ દ્વારચ્યુર્ણિ,’ હારિલક્ષ્મી ‘અનુયોગદ્વાર રીકા,’ ગન્ધ હરિત હારિલક્ષ્મી તત્વાર્થરીકા, મલ્ય-ગિરિ-ઘનતસંગ્રહણીવૃત્તિ, હારિલક્ષ્મી ઘનતસંગ્રહણીવૃત્તિ, લગ્વતીવિવરણ, વિશેષખુવતી, સૂર્યમંત્રસિન્ધુક્તિ વગેરે.

### ૨૧ શ્રીમલયગિરિજી

તેઓ તેરમી શતાબ્દિની શરૂઆતમાં થયાનો સંભવ છે. તેઓ એક સમર્થ ટીકાકાર હતા. અનેક આગમો પર તેઓએ રીકા લખી છે. તેમની રીકા ધણી સરલ અને તલસ્પર્થીં

૧ આ અંથ ઉપર અમાએ વૃત્તિ બનાવી છે. તે વૃત્તિ થોડા સમય બાદ જૈન સાહિત્યવર્ધક સભા-સુરત તરફથી પ્રસિદ્ધ થશે.

હોય છે. ધથ્યા કઠિન વિષયો પણ તેઓની કદમથી સહેલા બની ગયા છે. જ્યોતિષના પણ તેઓનો અસાધારણું હાતા હતા. સૂર્યપ્રતિપિત, ચંદ્રપ્રતિપિત, જ્યોતિષકરંડક વગેરે જ્યોતિષ અન્યો પર તેઓએ ટીકા રચી છે. જ્યોતિષ સમ્યાન્ધના ડેટલાએક વિષયોના સ્પષ્ટીકરણું માટે પ્રત્યક્ષ જોવા માટે વિહાર કરીને તેઓ નેપાલમાં ગયા હતા. ‘ધર્મસંઅહલીકૃતિ’ થી તેઓનો સારા ન્યાયવેતા હતા તે સાખીત થાય છે. છ હજાર શ્લોક પ્રમાણું ‘મુષ્ટિ’ નામનું વ્યાકરણું પણ તેમણે બનાવેલ છે.

### ૨૨ શતાર્થિક શ્રીસોમપ્રલસ્ત્રિલુ

તેઓનો તેરેભી શતાર્થિમાં થયા. તેઓનો એક વિષયાત વિદ્ધાન હતા. તેમની કવિત્વશક્તિ અદ્ભુત હતી. તર્ફ શાસ્ત્રમાં પણ તેઓનો નિપુણ હતા. જો કે તેઓનો ડોઈ પણ ન્યાયઅંથ કે ન્યાયનો પ્રસંગ ઉપલબ્ધ નથી તો પણ તેઓનાં પ્રલાઘ અને પ્રતિલાઘ અપૂર્વ હતાં, તેનું ડેર ડેર વર્ણન મળે છે.

### ૨૩ કલિકલિસર્વિશ શ્રીહેમયંદ્રસ્ત્રિલુ

તેમનો જ્ઞ-મ વિ. સં. ૧૧૪૫ ની કાર્તિકી પૂર્ણિમાને હિસે થયો હતો. તેમની દીક્ષા ૧૧૫૦ માધ શુ. ૧૪ ને શનિવારે, આચાર્ય પદ ૧૧૬૨ માં, અને ૧૨૨૮ માં સ્વર્ગવાસ થયો. તેઓનો એક સમર્થ મહાપુરુષ હતા. અનેક રાજયાનો. તેમના લક્ષ્ણ હતા. તેમનાં શક્તિ અને જ્ઞાન અનેડ હતાં. તેમના સમયમાં પરદર્શનીએનો વિરોધ વિરોધ હતો. તો પણ તેમણે પોતાની અદ્ભુત પ્રતિલાથી અનેક વખત તેઓને પરાભૂત કર્મ હતા. તેમના નામથી, જીવનથી કે કબ્નથી ડોઈ પણ વિદ્ધાન અણુઝાણું હશે એમ કહી શકાય નહિ. તેમની કલમ સર્વતોમુખી હતી. ડોઈખણું વિષય એવો નથી કે જેમાં તેમની કલમ કે પ્રતિલાઘ ન ચાલી હોય. ન્યાય વિષયમાં તેમણે ‘પ્રમાણુભીમાંસા’ રોપણ વૃત્તિ યુક્તા, ‘અન્યયોગબ્યવચ્છેદિકા,’ ‘અયોગબ્યવચ્છેદિકા,’ ‘શ્રી વીતરાગસ્તવપ્રકાશ’ વગેરે અન્યો રચ્યા છે. તેમની કલમ ધર્મી જીવન સચોટ અને અસરકારક છે. તેમનું એક એક વાક્ય હુદયમાં સોંસનું જીતરી જય છે. તેમના લખાણુથી તેમને જૈનદર્શનની ડેટલી દાજ હતી એ સ્પષ્ટ સમજય છે.

તેમનો ‘પ્રમાણુભીમાંસા’ અન્ય પાંચ અધ્યાય પ્રમાણું હતો. હાલમાં પ્રથમ અધ્યાયના એ આદ્ધિક તથા ભીજા અધ્યાગનું એક આદ્ધિક એટલું મળે છે. તેટલામાં પણ તેઓએ ધથ્યાંજ સંશોધ કર્યો છે. તે ઉપરથી સમજ શકાય છે કે સમૃપૂર્વ અન્ય ડેટલો વિસ્તૃત હશે? તેમની ‘અન્યયોગબ્યવચ્છેદિકા’ ઉપર શ્રીમલિકેષેણુસ્ત્રિલુએ ‘સ્વાદાદમંજરી’ નામની સુન્દર ટીકા બનાવી છે. હાલમાં જૈનદર્શનમાં તે છૂટથી વંચાય છે. તેમની લખાણું શૈલી ઉદ્ઘનાચાર્યને મળતી છે. તેઓનો ‘અનુશાસન’ અન્તે આવે એવા અન્યો રચતા. તેમનો એક વાણનુશાસન નામનો અન્ય હતો, હાલમાં તે મળતો નથી. જૈન-ન્યાયનો સર્વ શ્રીહેમયંદ્રસ્ત્રિલુના સમયમાં જૈનશાસનિપી નભસ્તલના મધ્યમાં પહોંચી મધ્યાહ્નાં પ્રયંક કિરણોને પ્રસારતો હતો.

### ૨૪-૨૫ શ્રીગુણયંદ્રસ્ત્રિલુ તથા શ્રીગુણયંદ્રસ્ત્રિલુ

આ આચાર્ય તેરમા સૈકામાં થયા. એ બન્ને શ્રીહેમયંદ્રસ્ત્રિલુના શિષ્ય હતા. તેમાં શ્રીગુણયંદ્રસ્ત્રિલુ સાહિત્યમાં અદ્ભુતીય વિદ્ધાન હતા. તેમણે સો કાંપ્યઅન્યો રચ્યા છે. અને

૧ શાખાનુશાસન, કાળ્યાનુશાસન, છન્દોનુશાસન, લિઙ્ગાનુશાસન વગેરે તેમની ઇતિ છે.

‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ઉપર ૫૩૦૦૦ શ્લોકપ્રમાણું ન્યાસ રચ્યો છે. તે બન્નેએ મળી સ્વેપત્રવૃત્તિ કુક્તા ‘દ્રાગલાંકાર’ નામનો ન્યાયન્થ રચ્યો છે. તેમાં ત્રણ પ્રકાશ છે. પહેલામાં જીવદ્રવ્યનું સ્વરૂપ, ભીજામાં પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ ને ત્રીજામાં ધર્મધર્મ આકાશ આદિનું સ્વરૂપ-આ સર્વ પ્રમાણુથી સિદ્ધ કરેલ છે.

### ૨૬ શ્રી પદુભેનસૂરિજી

તેઓ તેરમા સૈકામાં થયા. તેમણે ‘વાદસ્થલ’ નામનો એક અન્ય રચ્યો છે, જેમાં જિનપતિસૂરિના ભતાનુયાયિઓ ‘ઉદ્ઘનવિહારમાં પ્રતિકૃત થયેલ જિનબિન્ધો પૂજનીય નથી’, એમ કહેતા હતા તેનું ખ'ડન છે.

### ૨૭ શ્રી રત્નપ્રકાશસૂરિજી

તેઓ બારમા-તેરમા સૈકામાં થયા. તેઓ વાહિદેવસૂરિજીના પદાલાંકાર અને ન્યાયના આપૂર્વ વિદ્યાન હતા. વાહિ દેવસૂરિજીના ‘સ્વાદાદરતનાકર’માં તેઓએ સહકાર આપ્યો હતો. તેમની સંસ્કૃત લખવાની શક્તિ અન્ય હતી. તેમણે ‘સ્વાદાદરતનાકર’માં પ્રવેશ કરવા માટે ‘પ્રમાણુન્યતત્તવાદેક’ ઉપર ‘રત્નાકરાવતારિક’ નામની લધુ વૃત્તિ રચ્યો છે, તે ધણી વિદૃતા-પૂર્ણ અને પ્રતિબાધાલિની છે. તેમાં યૌધ, નૈયાયિક ‘અર્થાટ’ અને ‘ધર્મોત્તર’નો ઉલ્લેખ છે. તેમાં શાષ્ટાની રમક-રમક ધણી જ છે. ચક્ષુપ્રાયકારી છે કે અપ્રાયકારી એ વિષયનો વાદ સમ્પૂર્ણ વિવિધ છન્દોમાં શ્લોકાયદ લખ્યો છે. જગતકૃત્વનો વિધંસ કુક્તા તેર વર્ણું, ત્રણ સ્યાદિવિભક્તિ અને એ ત્યાદિવિભક્તિમાં જ ગોડાયો છે, તે આ પ્રમાણે—

ત્યાદિવચનદ્વયેન, સ્યાદિકવચનત્રયેણ વર્ણેસ્તુ ।

ત્રિભરધિકૈર્વિશભિરયં વ્યધાયિ શિવસિદ્ધિવિચ્છંસઃ ॥

( તિ, તે, । સિ, ટા, ડસ, । તથદ્વધન, પબભમ, યરલવ । ) પોતાની આ વૃત્તિ માટે તેઓએ જ અન્તે લખ્યું છે કે

વૃત્તિઃ પञ્ચસહસ્રાણિ, યેનેયં પરિપઠયતે ।

ભારતી ભારતી ચાસ્ય, પ્રસર્પન્ત પ્રજલ્પત: ॥

‘નૈના વડે આ પાંચ હજાર શ્લોકપ્રમાણું વૃત્તિ ભણ્યાય છે, મોલતા એવા તેની પ્રલાંઅાનંદ અને વાણી વિરતારને પામે છે.’

તેમણે ભીજ પણ ‘નેમિનાથચરિત’, ‘ઉપહેશમાલા દીકા’, ‘મતપરીક્ષા પંચાશત’ વગેરે અન્યો રચ્યા છે.

એ પ્રમાણે આ સાતસો વર્ષમાં નૈન ન્યાયનો સર્વ બ્રહ્માંદ્રાગણને અનુભવતો હતો. અને તે સમયમાં થયેલ આચાર્યો તેની આડે આવતાં વાણોને વિષેરી નાણી તેના પ્રકાશને પ્રસારતા હતા. આજ પણ આપણું માટે તે આચાર્યોએ પ્રસારેલ કિરણોનો પ્રકાશ અન્યાન્યે વિવિધમાન છે. તો તે પ્રકાશમાં વિચરીને અન્ધકારની પીડાથી બણ્યો આનન્દિત થશું.

આ લેખ પ્રલાંકચરિત, ચતુર્વિંશતિ પ્રયન્ધ, નૈન સાહિત્યનો સંક્ષિપ્ત ધતિહાસ તથા આ લેખમાં આવતા ન્યાયઅન્યોમાંથી ઉપલબ્ધ અને પ્રાપ્ત થયેલ અન્યોના અવલોકનથી લખાયેલ છે, એટલો આવશ્યક ઉલ્લેખ કરી આ લેખ સમાપ્ત કરું છું.

યાકિનીધર્મસૂનુ પૂજનીય આચાર્યદેવ

# શ્રીમહૃત્રિભક્તિશ્રીશરણ

[ તેચોશ્રીના લુણ અને કવનની નોંધ ]

લેખક:-પૂ. મુનિમહારાજ શ્રી કનકવિજયલુ, ધ્રાગદ્રા  
( ચુ. આ. મ. શ્રી. વિજયરામચંદ્રસૂરિશિષ્ય )

અ

ધર્મસંસ્કૃતિ એ ભારતવર્ષની પ્રાચીન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના આદર્શને જીવીને પોત પોતાના હષ્ટિકાણુથી તેને પચાવનારાં અને જગતમાં પ્રચારનારાં છ દર્શનો મુખ્યતા: અસ્તિત્વાને ધરાવનારાં છે. તે છ દર્શનો આ મુજબ છે: પૌઢ, નૈયાયિક, સાંઘ્ય, ક્લૈન, વૈશેષિક અને કૈમિતીય; અથવા ન્યાય તેમજ વૈશેષિક દર્શનને અસુક દૃષ્ટિયે અલિન સ્વીકારતાં છેલ્લું ચાર્ચાડ દર્શન. 'પૂર્ણાનસમુખ્ય'માં આ કુમથી ષદ્રદ્ધનોનું નિર્દ્દિષ્ટ કરવામાં આવ્યું છે.

નૈનદર્શન આ છ દર્શનોનાં સર્વશ્રીષ્ટ ધર્મદર્શન છે. ત્રિકાલાયાધ્ય અને અવિસ્થંગત અનેકાન્તતત્ત્વવ્યવસ્થાના નક્કર પાયા પર શ્રી નૈનદર્શનની લખ્ય ધમારત ડાબેલી છે, કે જેના એક પણ કંગરાને હલાવવાને કાર્ધ સમર્થ નથી. આ કારણે જગતનાં સર્વ ધર્મદર્શનોનાં મેરુની જેમ અડગ બનીને નૈનદર્શન સૌની મોખરે ડાબું છે.

નૈનદર્શનની પ્રતિપાદનશૈલી અનુપમ છે. એની તત્ત્વવ્યવસ્થા અવિસ્વાદિની છે. આથી જ જગતના ધર્તિર ધર્મદર્શનોનાં જળવાઈ રહેલી અભાધ્ય તત્ત્વવ્યવસ્થા પણ નૈનદર્શનમાંથી જ જિતરી આવેલી છે એમ કહી શકાય. 'ધર્તિર સર્વ દર્શનોનું ભૂળ નૈનદર્શન છે' આ મુજબનું પ્રામાણિક વિધાન કાર્ધ પણ પ્રકારના આગ્રહ વિના કરી શકાય તેમ છે.

કહેતું જોઈ એ કે: ધર્તિર સર્વ દર્શનોની જેમ નૈનદર્શનનો આધાર તેનું વિશાળ સાહિત્ય છે. નૈનદર્શનનું સાહિત્ય સર્વતોમુખી, અમાપ અને અપ્રતીમ છે. ભૂતકાલીન શાસન-પ્રભાવક પૂજનીય નૈનાચાર્યોએ પોતાની અપૂર્વ પ્રતિબા, અખાડ શાસનરાગ અને અપ્રતીમ પ્રભાવકશરિતિ, આ વગેરેના યોગે, શ્રી નૈનદર્શનના સાહિત્યવૃક્ષને સારી રીતે નવપલલિત રાખ્યું છે, કે તે ફાલ્યા-ફૂલ્યા સાહિત્યવૃક્ષનાં સુભધુર ઝોણે આપણે આપણે, તેવા પ્રકારના વિશેષ પ્રયત્નો વિના, સુખપૂર્વક ચાખવાને ભાગ્યશાળી બન્યા છીએ.

નૈનશાસનના વિસ્તૃત આકાશપદપર જગ્યાળાતે પ્રકાશ પાથરનારૂ ભૂતકાલીન અગધ્ય ચૂર્ણિવોર્યપ તારકગણુની મધ્યમાં યાકિનીધર્મસૂનુ આચાર્યભગવાન શ્રીહરિભક્તિશ્રીશરણ મહારાજનું સ્થાન અતિશય ગૌરવભર્યું છે. એ પૂજનીય સુરીશરણી પ્રૌદ પ્રતિબા, અવિહંડ શાસનરાગ અને ન્રિવિધયોગે નૈન સાહિત્યની સેવા કરવા માટેની અપૂર્વ અર્પિતવૃત્તિ: આ જલ્દીયાના યોગે તેચોશ્રીનું પુણ્યનામ નૈન તવારીખમાં સુવર્ણાક્ષરે નોંધાયું છે.